



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની જાહેરાત

(જા. ક. ૮૨/૧૬-૧૭ એકાઉન્ટન્સી વિષયના મદદ. પ્રાધા. વર્ગ-૨ અને
જા. ક. ૮૭/૧૬-૧૭ આંકડાશાસ્ત્ર વિષયના મદદ. પ્રાધા. વર્ગ-૨ માં NET / SLET/
SET / Ph.D. પદવી બાબત)

આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજો ખાતેના એકાઉન્ટન્સી વિષયના મદદ. પ્રાધા. વર્ગ-૨, જા.ક.૮૨/૧૬-૧૭ ની ભરતી માટે અપાત્રતાના કારણો સહિતની યાદી તા. ૦૪/૦૬/૨૦૧૮ ના રોજ આયોગની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે તથા જા.ક.૮૭/૨૦૧૬-૧૭ આંકડાશાસ્ત્ર વિષયના મદદ. પ્રાધા. વર્ગ-૨ ની અરજી ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે. સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજો ખાતેના જુદાજુદા વિષયના મદદ. પ્રાધા. વર્ગ-૨ની જાહેરાતના ભરતી નિયમો મુજબ શૈક્ષણિક લાયકાત તરીકે અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ ૫૫% કે સમકક્ષ ગ્રેડ તથા મૂળભૂત વિષયમાં NET / SLET/ SET ની પરીક્ષા ઉત્તિર્ણ કરેલી હોવી જોઈએ અથવા Ph.D. પદવી ધરાવતાં હોવા જોઈએ તેવી જોગવાઈ છે. સરકારશ્રીના શિક્ષણ વિભાગના નિર્ણય અનુસાર જે વિદ્યાશાખામાં NET / SLET/ SET ની પરીક્ષા લેવામાં આવતી ન હોય તેવા વિષયમાં લઘુત્તમ લાયકાત તરીકે Ph.D. પદવી ગણવાની રહે છે. UGC દ્વારા NET / SLET/ SET ની પરીક્ષામાં Accountancy/ Statistic વિષયની અલગ વિષય તરીકે કોઈ પરીક્ષા લેવાતી નથી, સદર જાહેરાત અંતર્ગત અરજી કરનાર ઉમેદવારો આ કારણથી Accountancy /Statistic માં NET / SLET/ SET ઉત્તિર્ણ કર્યાનું સર્ટીફિકેટ ધરાવતાં નથી તેમજ તેઓની Ph.D. ની પદવીમાં Commerce વિદ્યાશાખાનો ઉલ્લેખ થયેલ છે. આવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવા સંદર્ભે તેઓની પદવી સંબંધિત (Accountancy / Statistic) ના વિષય / વિદ્યાશાખામાં જ છે તે પુરવાર થવા હેતુ જા. ક. ૮૨/૧૬-૧૭ એકાઉન્ટન્સી તથા જા.ક.૮૭/૨૦૧૬-૧૭ આંકડાશાસ્ત્ર વિષયના મદદ.પ્રાધા. વર્ગ-૨ માં Ph.D. પદવી અંતર્ગત Thesis નું Title તથા આ અંગેનું યુનિ. ના ફેકલ્ટી ડિન તથા રજીસ્ટ્રાર ની સંયુક્ત સહિ તથા સિક્કાવાળું પ્રમાણપત્ર (નમૂનો સામેલ છે) તેમજ અન્ય કોઈ આનુસાંગિક જરૂરી આધાર/પુરાવા સહિત તા.૨૦/૦૬/૨૦૧૮ ના કચેરી સમય સુધીમાં બીનચૂક રજુ કરવા જણાવવામાં આવે છે. નિયત મુદત બાદ રજુ થયેલ રજુઆત કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં.
તા. ૦૮/૦૬/૨૦૧૮

પ્રમાણપત્ર નો નમૂનો

(જા. ક. ૮૨/૧૬-૧૭ એકાઉન્ટન્સી વિષયના મદદ. પ્રાધ્યા. વર્ગ-૨ અને

જા. ક. ૮૭/૧૬-૧૭ આંકડાશાસ્ત્ર વિષયના મદદ. પ્રાધ્યા. વર્ગ-૨ માં Ph.D. પદવી બાબત)

નામ:

પદવી પ્રમાણપત્ર મેળવ્યાનું વર્ષ:

યુનિવર્સિટી:.....

Thesis નું Title:

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, શ્રી/શ્રીમતી/કુ.....એ

Ph.D ની પદવી.....વિષય મેળવેલ છે.

Faculty Dean

Registrar